

ત્વરિત જાહેરાત માટે

## સિટીએ બ્રમ્પટન ખાતેની આરોગ્ય સંભાળના વિસ્તરણમાં સહાયતા માટે એક ટકો હોસ્પિટલ લેવિ વસૂલવા માટે મંજૂરી આપી

બ્રમ્પટન, ઓન્ટારિયો (07 એપ્રિલ 2022) – જઈ કાલે હાથ ધરાયેલી સભામાં બ્રમ્પટન સીટી કાઉન્સિલે આરોગ્ય સંભાળના વિસ્તરણમાં સહાયતા માટે એક ટકો હોસ્પિટલ લેવિ વસૂલવા માટે મંજૂરી આપી હતી. બ્રમ્પટન સિવિક હોસ્પિટલમાં સ્થાપિત થનાર પીલ મેમોરિયલ હોસ્પિટલ અને કેન્સર કેર સેંટરના વિસ્તરણ અને પુનઃવિકાસ માટે સ્થાનિક હિસ્સામાં યોગદાન આપવામાં આ લેવિ સહાય કરશે.

વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમના અંદાજ પ્રમાણે પીલ મેમોરિયલ હોસ્પિટલના વિસ્તરણ અને પુનઃવિકાસ માટે \$700 મિલિયનનો ખર્ચ થશે અને અને કેન્સર કેર સેંટરના વિકાસ માટે \$365 મિલિયનનો ખર્ચ થશે જેની સંયોજિત કિંમત \$1.1 બિલિયન જેટલી થશે. આ પરિયોજનાઓ માટે આવશ્યક સ્થાનિક હિસ્સો \$250 મિલિયન જેટલો છે. ઓસ્લર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે સિટીએ અંદાજિત સ્થાનિક હિસ્સાના 50 ટકા જેટલું ભંડોળ પ્રદાન કરવું જોઈએ, જે અંદાજિત \$125 મિલિયન જેટલું થાય.

આ હોસ્પિટલ લેવિના પરિણામે બ્રમ્પટનવાસીઓને સરેરાશ વાર્ષિક રહેવાસી વેરાના બિલમાં સરેરાશ \$23.29 જેટલો વધારો જોવા મળશે. 2022ના અંદાજપત્રના ભાગ તરીકે સિટીએ [આરોગ્ય સંભાળ વિસ્તરણ માટે પોતાની પ્રતિબદ્ધતા](#) ભંડોળની \$62.5 મિલિયન જેટલી રકમ પીલ મેમોરિયલ હોસ્પિટલ માટેના સ્થાનિક હિસ્સા માટે નિયુક્ત કરેલી દર્શાવી. આ પ્રતિબદ્ધતાના અનુમોદન રૂપે આ હોસ્પિટલ લેવિની મંજૂરી આવી છે. રહેવાસી વેરાના અંતિમ બિલ જુનમાં મોકલાશે જેના હપતા જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચૂકવવાપાત્ર હશે. વેરા અંગેની વધુ માહિતી [Brampton.ca](#) પર મળી શકશે.

ઐતિહાસિક દ્રષ્ટિએ બ્રમ્પટનને આરોગ્ય સંભાળ સેવાઓ અન્વયે તેમને મળવું જોઈએ એટલું ભંડોળ મળ્યું નથી જેને પરિણામે હોસ્પિટલોમાં ભીડની સમસ્યા થઈ અને હોલવે મેડિસિનનો સહારો લેવો પડ્યો અને આ સમસ્યાની તીવ્રતા COVID-19ની મહામારીને કારણે વધી ગઈ. જાન્યુઆરી 2020માં સીટી ઓફ બ્રમ્પટનને આરોગ્ય સંભાળની કટોકટી જાહેર કરી અને "ફોર ડીલ ફોર બ્રમ્પટન" તરીકે ઓળખાતી હિમાયતલક્ષી ઝુંબેશનું લોકાર્પણ કર્યું, જેમાં પ્રોવિન્સ પાસેથી વધારાના ભંડોળ માટે વિનંતી કરવામાં આવી જેથી બ્રમ્પટનની આરોગ્ય સંભાળની ત્રુટીઓના અવકાશને ભરી શકાય.

માર્ચ 2021માં, સિટીએ [પ્રોવિન્સલ સરકારની અંદાજપત્ર અંગેની જાહેરાતને આવકારી હતી](#) જેમાં ઓસ્લર્સ પીલ મેમોરિયલ સેંટર ફોર ઈન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલનેસનું એક નવા હોસ્પિટલ તરીકેના વિસ્તરણનો મુદ્દો સામેલ હતો. આ સપ્તાહના પૂર્વાર્ધમાં [પ્રોવિસ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેઓ \\$21 મિલિયનનું રોકાણ](#) કરવા જઈ રહ્યા છે જેથી ઓસ્લરનું પીલ મેમોરિયલના નવા ઈનપેશન્ટ હોસ્પિટલમાં પરિવર્તન

કરવાના મુદ્દાને સમર્થન આપી શકાય જેમાં 24/7 ઈમેર્જન્સી ડિપાર્ટમેન્ટ હશે અને બ્રેમ્પટન સિવિક હોસ્પિટલ ખાતે કેન્સર કેર સર્વિસિસનું વિસ્તરણ કરવામાં આવશે.

ફેર ડીલ ફોર બ્રેમ્પટન અભિયાન અંગે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો [Brampton.ca](http://Brampton.ca).

## સુવાક્યો

ઐતિહાસિક દ્રષ્ટિએ બ્રેમ્પટનને આરોગ્ય સંભાળ સેવાઓ અન્વયે તેમને મળવું જોઈએ એટલું ભંડોળ મળ્યું ન હોવાને પરિણામે હોસ્પિટલોમાં ભીડની સમસ્યા અને હોલવે મેડિસિનનો સહારો લેવાનો અનુભવ થઈ ચુક્યો છે. બ્રેમ્પટન સીટી કાઉન્સિલ બ્રેમ્પટનની આરોગ્ય સંભાળના અવકાશને દૂર કરવામાં અમે અમારો ભાગ ભજવવા માટે પ્રતિબદ્ધ છીએ, અને અમે અમારા સમુદાયમાં આરોગ્ય સંભાળ સેવાઓને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરવા બદલ અમારા ભાગીદારોનો આભાર માનીએ છીએ."

- હરકિરત સિંઘ, સિટી કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"ગત વર્ષે ટેલિ ટાઉન હોલમાં, સિટી દ્વારા મતદાન કરાયેલા 70 ટકાથી વધુ રહેવાસીઓએ સૂચિત કર્યું હતું કે તેઓ બ્રેમ્પટનમાં નવી સંપૂર્ણ સેવા ધરાવતા હોસ્પિટલને ભંડોળ પૂરું પાડવા માટેની લેવિની વસૂલાતને સમર્થન આપે છે. આપણા સમુદાયને આરોગ્ય સંભાળ સેવાઓ અન્વયે આપણને મળવું જોઈએ એટલું ભંડોળ ભૂતકાળમાં મળ્યું નથી જેને પરિણામે હોસ્પિટલોમાં ભીડની સમસ્યા થઈ અને હોલવે મેડિસિનનો સહારો લેવો પડ્યો અને આ સમસ્યાની તીવ્રતા COVID-19ની મહામારીને કારણે વધી ગઈ. બ્રેમ્પટન સીટી કાઉન્સિલ આપણા રહેવાસીઓના આરોગ્ય અને સુખાકારીનું રક્ષણ થાય અને આપણા સમુદાયને તેમને લાયક આરોગ્ય સંભાળ મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે અમારો ભાગ ભજવવા માટે સમર્પિત છીએ.

- પેટ ફોર્ટીની, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 7 અને 8, સીટી ઓફ બ્રેમ્પટન

બ્રેમ્પટન સૌથી વધુ ઝડપથી વિકસતા સમુદાયો પૈકી એક છે એક સુશાસિત શહેર તરીકે અમે બ્રેમ્પટનમાં આરોગ્ય કટોકટીને ધ્યાન પર લઈને ભવિષ્યની આરોગ્ય સંભાળની આવશ્યકતાઓ પૂર્ણ કરવા પગલાં લઈ રહ્યા છીએ. અમે અમારા રહેવાસીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીના હિતમાં અમારા સહયોગીઓ સાથે કાર્ય કરવાનું ચાલુ રાખવા અને બ્રેમ્પટનમાં આરોગ્ય સંભાળ માટે વધુ મજબૂત ભવિષ્ય સુરક્ષિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટનમાં આરોગ્ય સંભાળ માટે આ એક ઐતિહાસિક સમય ગણી શકાય. હોસ્પિટલના પુનઃવિકાસ માટે વર્તમાન અંદાજિત સ્થાનિક હિસ્સાના 50 ટકાને સહાય આપવાની સિટી કાઉન્સિલની પ્રતિબદ્ધતા એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે ઓસ્લર પાસે આ સમુદાયની જરૂરિયાત અને લાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સંસાધનો નિશ્ચિતપણે છે. ઓસ્લર સિટી કાઉન્સિલને આ સાહસિક અને આવશ્યક પગલું

ભરવા માટે અને આપણા ઝડપથી વિકસતા સમુદાયની સેવા કરવા માટે હોસ્પિટલની વધુ ક્ષમતા ઊભી કરવાના આશયને અથાકપણે સમર્થન આપવા બદલ પ્રશંસા કરે છે. કાઉન્સિલની પ્રતિબદ્ધતા એ ભાવિ વર્ષો માટે આપણા સમુદાયના આરોગ્ય માટે ફરેલ રોકાણ છે.

- જીઓફ્રી રિચી, પ્રમુખ, વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)